



સ્ત્રી જનનાંગ છેદન

સ્ત્રી જનનાંગ છેદન એટલે શું?

સ્ત્રી જનનાંગ છેદન એ કોઈ તબીબી કારણ વગર સ્ત્રીના જનન વિસ્તારને જાણીજોઈને કાપવાનું કે તેમાં ફેરફાર કરવાનું કૃત્ય છે. કાપવું, શસ્ત્રક્રિયાથી સ્ત્રીના જનનાંગ પરની ચામડી કાઢી નાખવી અને ધાર્મિક વિધિ રૂપે સ્ત્રી શસ્ત્રક્રિયા સહિત તેનાં ઘણાં નામો છે. તે સ્ત્રીના આરોગ્ય માટે નુકસાનકારક છે અને જરૂરી નથી.

જો તમે કે તમારી ઓળખીતી વ્યક્તિ જોખમમાં હોય તો **૦૦૦** પર પોલીસને ફોન કરો.

ઓસ્ટ્રેલિયામાં પોલીસ પાસે જવું સલામત છે અને તેમના પર વિશ્વાસ કરી શકાય છે.

મફત અને ખાનગી સલાહ અને માહિતી માટે 1800RESPECT ને **1800 737 732** પર ફોન કરો.

જો તમારે મફત દુભાષિયા સેવાની જરૂર હોય તો **131 450** પર ફોન કરો.

ઓસ્ટ્રેલિયામાં તબીબી મદદ અને સહાયતા ઉપલબ્ધ છે.

જો તમે આમાંની કોઈ એક પ્રક્રિયાથી અસરગ્રસ્ત થયા હો, તો તમે ઓસ્ટ્રેલિયામાં મફત આરોગ્ય સંભાળ અને મદદ પ્રાપ્ત કરી શકો છો. ડૉક્ટરો, નર્સો, બીજા તબીબી વ્યાવસાયિકો અને શિક્ષકો તમને મદદ કરી શકે છે.

જો તમે બાળક પેદા કરવાનું આયોજન કરતા હો, તો તમે જ્યારે ગર્ભવતી હો ત્યારે અને જ્યારે તમને બાળક જન્મે ત્યારે વધુ સહાયતા મેળવવા તમે ડૉક્ટર, નર્સ અથવા બીજા તબીબી વ્યાવસાયિક સાથે વાત કરવા ઇચ્છતાં હોઈ શકો છો.

સ્ત્રી જનનાંગ છેદન એ ઓસ્ટ્રેલિયામાં એક ગંભીર ગુનો છે.

સ્ત્રી જનનાંગ છેદન એ ઓસ્ટ્રેલિયામાં ગેરકાયદેસર છે. તેમાં આ પ્રકારની પ્રક્રિયા કરાવવા માટે વ્યક્તિને દેશની બહાર મોકલવી, અથવા આ પ્રક્રિયા કરાવવા માટે કોઈને સગવડ કરી આપવી, મદદ કરવી અથવા પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે.

આવા ગુના કરનાર વ્યક્તિ, સ્ત્રી હોય કે પુરુષ, તેને જેલની સજા થઈ શકે છે.

જો તમે આમાંની એક પ્રક્રિયાથી અસરગ્રસ્ત થયા હો, તો તમને મદદ માગવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે અને તમને ઓસ્ટ્રેલિયાના કાયદા હેઠળ સજા નહીં થાય.

બીજી સેવાઓ અને સંસાધનો છે જે મદદ કરી શકે છે.

તમને સ્ત્રી જનનાંગ છેદન અંગે જાગૃતિ માટેની રાષ્ટ્રીય શિક્ષણની ટૂલકિટ (National Education Toolkit for Female Genital Mutilation/Cutting Awareness) ની વેબસાઇટ www.netfa.com.au પર સ્ત્રી જનનાંગ છેદન વિશે માહિતી મળી શકે છે.

1800RESPECT એ જાતીય સતામણી, ઘરેલુ અને પારિવારિક હિંસાનો ભોગ બનેલાઓને સલાહ આપતી ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય સ્તરની સેવા છે (Australia's National Sexual Assault, Family and Domestic Violence Counselling service). તે મફત અને ખાનગી સલાહ અને માહિતી, ફોન પર અને ઓનલાઇન આપી શકે છે. સલાહ આપનાર તમારી વાતો સાંભળે, તમારા પ્રશ્નોના જવાબ આપી શકે અને તમારી નજીકના વિસ્તારમાં ઉપલબ્ધ બીજી મદદ કરતી સેવાઓ તરફ તમને દોરી શકે છે.

1800 737 732 પર ફોન કરો અથવા **1800RESPECT** ની વેબસાઇટ **www.1800RESPECT.org.au** પર જાઓ. જો તમને, કે તમારા કોઈ ઓળખીતાને આ પ્રક્રિયા માટે દેશની બહાર લઈ જવામાં આવ્યા હોય અથવા જો તમને લાગતું હોય કે તેઓ પ્રક્રિયા માટે દેશની બહાર લઈ જવાનું જોખમ ધરાવે છે, તો 24/7 દૂતાવાસ સંબંધિત કટોકટી કેન્દ્ર (Consular Emergency Centre) ને **1300 555 135** પર (ઓસ્ટ્રેલિયાથી) અથવા **+61 2 6261 3304** પર (દેશની બહારથી) ફોન કરો અથવા **dfat.gov.au** પર ઓસ્ટ્રેલિયાના સૌથી નજીકના ઓવરસીઝ મિશનનો સંપર્ક કરો.

શું તમારે દુભાષિયાની જરૂર છે?

131 450 પર ભાષાંતર અને દુભાષિયા સેવા (Translating and Interpreting Service) (TIS) માટે ફોન કરો. TIS માંથી દુભાષિયો તમને બીજી સેવાઓ સાથે વાતચીત કરવામાં મદદ કરી શકે છે. જોકે, TIS સલાહ સૂચન કરતી નથી. બધા કોલ્સ મફત અને ખાનગી હોય છે.